

## BIN VIDEO - TRANSCRIPT IN GUJARATI LANGUAGE

ENGLISH	GUJARATI
<p>1. Recycle all paper and cardboard items including cartons and magazines. Don't forget items from your bathroom such as toothpaste boxes and toilet roll tubes.</p> <p>2. All these items go into your blue recycling bin.</p>	<p>1. કાર્ટન અને મેગેઝિન સહિત તમામ કાગળ અને કાર્ડબોર્ડની વસ્તુઓને રિસાયકલ કરો. ટૂથપેસ્ટ બોક્સ અને ટોઇલેટ રોલ ટ્યૂબ જેવી વસ્તુઓ તમારા બાથરૂમમાંથી ભૂલશો નહીં.</p> <p>2. આ બધી વસ્તુઓ તમારા બ્લુ રિસાયકલિંગ બિનમાં નાખો.</p>
<p>3. Recycle plastic bottles, glass bottles and jars and food and drinks cans.</p> <p>4. Don't forget tin foil and trays.</p> <p>5. Remove bottle tops and place in your general waste bin.</p> <p>6. All these items go into your brown recycling bin.</p>	<p>3. પ્લાસ્ટિકની બોટલો, કાચની બોટલો, બરણીઓ તેમજ ખોરાક અને પીણાનાં ડબ્બા-કેનને રિસાયકલ કરો.</p> <p>4. ટીનમાંથી બનેલા ફોઇલ અને ટ્રેને ભૂલશો નહીં.</p> <p>5. બોટલનું ટોપ-ઢાંકણું કાઢીને તમારા સામાન્ય કચરાના ગ્રે (બ્લેક) બિનમાં નાખો.</p> <p>6. આ બધી વસ્તુઓ તમારા બ્રાઉન રિસાયકલિંગ બિનમાં નાખો.</p>

ENGLISH	GUJARATI
<p>7. Line your kitchen caddy with a compostable green liner and place all your food waste in to it, such as apple cores, bones and plate scrapings.</p> <p>8. Once full, place in your green recycling bin, which can also be used for garden waste.</p> <p>9. Before you run out of green liners you will find a tag in the centre of your roll, attach this to your green bin on bin day to request more from the crew.</p> <p>10. Alternatively you can pick these up for free from your local library.</p>	<p>7. તમારા રસોડાની કેડીમાં કમ્પોસ્ટેબલ ગ્રીન-લીલી પ્લાસ્ટિક બેગ રાખો અને સફરજન વગેરેનો બીયાંવાળો કઠણ ભાગ, થાળીમાં બચેલો ખોરાક અને હાડકાં જેવા તમામ ખાદ્ય કચરાને તેમાં મૂકો.</p> <p>8. એકવાર ભરાઈ જાય પછી, તમારા ગ્રીન-લીલા રિસાયકલિંગ બિનમાં નાખો, જેનો ઉપયોગ બગીચાનો કચરો નાખવા માટે પણ કરી શકાય છે.</p> <p>9. તમારા ગ્રીન લાઇનર્સ (લીલી પ્લાસ્ટિક બેગ) સમાપ્ત થાય તે પહેલાં, તમને તમારા રોલની મધ્યમાં એક ટેગ મળશે, કામદારો પાસેથી વધુ લાઇનર્સ મેળવવા માટે ટેગને તમારા ગ્રીન બિન પર બાંધો કે જોડો.</p> <p>10. તમે ગ્રીન લાઇનર્સ (લીલી પ્લાસ્ટિક બેગ)ને તમારી સ્થાનિક લાઇબ્રેરીમાંથી મફતમાં મેળવી શકો છો.</p>
<p>11. Side waste next to your bin will not be accepted and is considered as fly tipping which is illegal.</p>	<p>11. તમારી બિનની બાજુમાં રાખેલો કચરો લેવામાં આવશે નહીં અને તેને ફ્લાઇ ટિપિંગ તરીકે ગણવામાં આવે છે જે ગેરકાયદેસર છે.</p>

<p>12. Present your bins with the wheels facing the road without obstructing the pavement, so it is easily accessible to the crew.</p>	<p>12. ફૂટપાથને અવરોધ્યા વિના રસ્તાની બાજુમાં તમારા બિન રાખો, જેથી કામદારો તેને સરળતાથી લઈ શકે.</p>
<p>13. If you receive a tag on any of your recycling bins because the wrong items are in it, you need to check the recycling guidelines on the back of the tag and remove the incorrect items.</p>	<p>13. જો તમને તમારા કોઈ પણ રિસાયક્લિંગ બિન પર ટેગ મળે કારણ કે તેમાં ખોટી વસ્તુઓ નાખી છે, તો કૃપા કરીને ટેગની પાછળ રિસાયક્લિંગ માર્ગદર્શિકા ચકાસો અને ખોટી વસ્તુઓ કાઢી નાખો.</p>
<p>14. General waste is placed in your grey bin.</p>	<p>14. સામાન્ય કચરો તમારા ગ્રે (બ્લેક) બિનમાં મૂકવામાં આવે છે.</p>
<p>15. These items include nappies, plastic bags, pots, tubs and trays and film.</p>	<p>15. ગ્રે (બ્લેક) બિનમાં નેપ્પી, પ્લાસ્ટિકની થેલીઓ, વાસણો, ટબ, ટ્રે અને ક્લિંગ ફિલ્મ જેવી વસ્તુઓ નાખી-ફેંકી શકો છો.</p>